



RAN-2508000605050007

T.Y. B.Com. (Sem. - V) Examination October - 2025

SEC - Personal Tax Planning

Time: 1 Hours]

[Total Marks: 25

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book.
- (2) જમણી બાજુનાં આંકડા પ્રશ્નના સંપૂર્ણ ગુણ દર્શાવે છે.
Number on the right indicate full marks of the question.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. ટૂંકમાં જવાબ આપો (ગમે તે પાંચ)

Answer in brief. (Any Five)

1. કર આયોજનના મુખ્ય હેતુઓ સમજાવો.
What are the main objectives of Tax Planning?
2. રહીશ માટે કોઈપણ બે માન્ય કપાત દ્વારા કર આયોજન જણાવો.
State Tax Planning through any two permissible deductions for residents.
3. આવકના ક્લબિંગનો અર્થ શું છે?
What is meant by clubbing of income?
4. પગારમાંથી ભથ્થું અને કરમુક્ત ભથ્થું શું છે?
What is allowance and exempt allowance from salary?
5. સમજાવો : પોસ્ટ ઓફિસ બચત યોજના
Explain: Post office savings scheme
6. પ્રકરણ VI-A હેઠળ કપાતના બે ઉદાહરણો લખો.
Write two examples of deductions under Chapter VI-A.
7. ULIP નું સંપૂર્ણ રૂપ જણાવો.
Expand ULIP.

(10)

પ્ર. 2. અ. મકાન મિલકતની આવક હેઠળ કર બચતના રસ્તાઓ જણાવો.

A. State various tax saving methods available under Income from House Property.

બ. રહેઠાણનાં દરજ્જા સંદર્ભે કર આયોજન સમજાવો.

B. Explain Tax Planning with reference to residential status.

(08)

(07)

અથવા / OR

પ્ર. 2. ટૂંકનોંધ લખો.

Short notes

1. કર આયોજન અને કરચોરીનો તફાવત
Differentiate between Tax Planning and Tax Evasion
2. અન્ય સ્ત્રોતોમાંથી આવક માટે કર આયોજન
Tax planning relating to Income from Other Sources
3. કલમ 80C હેઠળની કપાત
Deduction under Section 80C.

(15)